https://archive.org/details/bk1052/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

॥ૐ॥

KJ- BK- 4 -12

ગામ નખત્રાણા તા. ૩-૧૦-૨૫

સં.૧૯૮૨ના ભાદરવા વદ ૧૨ ને બુધવાર તા. સપ્ટેમ્બર ના રોજ આશરે ગામ નખત્રાણા પુર્વ બાજુના ભાઈયો તથા નખત્રાણાના ઉત્તર બાજુના મુખ્ય આગેવાનો તથા ભાઈયો તથા લોકો ગામ નખત્રાણા પુર્વ બાજુમાં શ્રી સદ્ગુરુ મહારાજ ભગવાનના મંદિરના હોલમાં ભેગા થયા હતા. ને તે સભામાં નીચે મુજબ કાર્ય કર્મ પસાર ~~કે~~ તેના નોંધ નીચે મુજબ

જે હાલે માસ ભાદરવા વદ ૮ સોમવાર ના ગામ વિથોણ મધે [illegible] પાર્ટી જે પિરાણા સતપંથી ભાઈયો તથા [illegible] તથા ગુજરાત ના અમુક ભાઈયો એકત્ર થયા હતા ને તે સભામાં (હિન્દુ ધર્મ પાળનાર આપણા ભાઈયો ને અણછાજતા બોલથી [illegible] ભરેલા શબ્દો વાપર્યા હતા) ને અમુક અમુક ગામના સનાતન ધર્મ પાળનારાઓને બોલાવી ને તે જાહેર સભામાં હડધુત કર્યા ~~હતા~~ છે. જેથી તે ભાઈયો તથા આપણા સનાતન ભાઈયોના લાગણી દુભાવી છે. ને તે પિરાણા સતપંથી ભાઈયો હિન્દુ સનાતન ધર્મ પાળનાર ઉપર [illegible] લાગણી ધરાવી રહ્યા છે. ને આપણી હાલતમાં જે અરસ પરસ કરવાનું [illegible] વહેવારમાં ~~ક~~ [illegible] પ્રસંગે મોટી [illegible] ઉભી કરવા [illegible] રહ્યા છે. જેથી આપણે ભેગા થવાનું કારણ બને છે. કારણ કે આપણે કેટલાક વર્ષો થયા હિન્દુ સનાતન ધર્મ પાળતા આવ્યા છીયે ને હજુ પણ પાળતા રહેશું ને તે ધર્મ બાબત જે જે કષ્ટ પડશે તે બધા સહન કરશું. ને (આપણા ગામમાં પણ કેટલાક મત ભેદ હોવાથી આપણે [illegible] નહી કરવું જોઈયે) આ નખત્રાણા ગામમાં આપણા સનાતન ધર્મ પાળનારના [illegible] સહી કરતા છે. જેના પણ નોંધ લેવા ને તે ભાઈયો ~~[illegible]~~ પ્રતિજ્ઞા લેવા આવે જે અમો હિન્દુ સનાતન ધર્મ પાળશું ને તે સમાજના જે જે નિયમો જાહેર પડ્યા છે તેનું પાલન કરશું ને હવે પછી જે ~~[illegible]~~ સમાજ ઉધ્ધારના તૈયાર કરશે તેનું પાલન કરવા અમો બાંહેધરી આપીયે છીયે. ને આ હિન્દુ ધર્મ પાળવા જતાં ~~કાર્યવાહકો ને~~ કાર્યવાહકો ને આગળ સમાજ ઉપર પિરાણા સતપંથી ભાઈયો [illegible] સંકટ કરે તો અમે સમાજને તન મન ધનથી મદદ કરવા અમારે પ્રતિજ્ઞા લઈયે છીયે ને બાંહેધરી આપીયે છીયે. જે જે વખત સમાજના હુકમ થશે તે પ્રમાણે અમો આપણા ધર્મનું રક્ષણ કરવા તૈયાર રહેશું તે અમો [illegible] સભામાં [illegible] બાંહેધરી આપીયે છીયે - જેના નોંધ નીચે મુજબ છે

realpatidar.com

નંબર	કુટુંબના વડાનું નામ	ઘરમાં જન સંખ્યા	[illegible]	[illegible]	ધર્મ શું પાળે છે.	સહીયો.
૧	રાંમજી ઈસરા રાંમજીયાણી ધંધો- ખેતી-	૧૯	૮	૧૧	~~[illegible]~~ સનાતન.	રાંમજી ઈસરા ના સહી દાં [illegible]
૨	ડાયા ભાઈ - [illegible]	૭	૨	૫	"	[illegible]
૩	[illegible]	૧૪	૩	૧૧	"	
૪	[illegible]	૨૬	૧૪	૧૪	"	
૫	[illegible]	૧૧	૬	૫	"	[illegible]

https://archive.org/details/bk1052/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1052/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:34:01 +05'30'
Real Patidar Unravel Truth

KJ- BK- 4-12

Date recorded as per Kutchhi Calendar in which new year starts with Ashadh month

realpatidar.com

॥ૐ॥

03-Oct-1945

ગ્રા.નખત્રાણા.તા. ૩-૧૦-૪૫

સં.૨૦૦૨ના. ભાદરવા વદ ૧૨ ને બુધવાર તા. ૩ ઓક્ટોબર ના. શુમારે ગ્રા. નખત્રાણા પૂર્વ નારાયણ ભાઈયો ત્યા નખત્રાણાના જ્ઞાતિ-પંચના મુખ્ય આગેવાનો ત્યા ભાઈયો ત્યા કહેલો ગ્રા. નખત્રાણા પૂર્વ નારાયણમાં શ્રી. સદ્ગુરુ જ્ઞાનાચાર્ય ભગવાનના મંદિરના હૉલમાં ભેગા થયા હતા. ને તે સભામાં નીચે મુજબ કાર્ય કર્મ યોજેલ [illegible]. તેના નોંધ નીચે મુજબ

25-Sep-1945

જે. હાલે ચાલતા સાલના ભાદરવા વદ ૮ સોમવાર ના ગ્રા. વિથોણ મધ્યે બાના પાર્ટી જે. નારાણ સતપંથી ભાઈયો જણે ધરમાડાના, ત્યા ગુજરાતના અમુક ભાઈયો એકત્ર થયા હતા ને તે સભામાં [હીન્દુ ધર્મ પાળનાર આપણા ભાઈયો ને અણછાજતા બોલથી નારખડાર ભરેલા શબ્દો વાપર્યા હતા] ને અમુક અમુક ગામના સનાતન ધર્મ પાળનારાઓને બોલાવી ને તે જાહેર સભામાં હડધુત કરયા ~~હતા~~ છે. જેથી તે ભાઈયો ત્યા આપણા સનાતન ભાઈયોના લાગણી દુભાવી છે. ને તે નારાણ સતપંથી ભાઈયો હીન્દુ સનાતન ધર્મ પાળનાર ઉપર બહુજ રોશના લાગણી ધરાવા રહ્યા છે. ને આપણી જ્ઞાતિમાં જે. ખરશી પરશી કરનાર જેથી વહેવારમાં ~~[illegible]~~ અથવા વિવાહના પ્રસંગે મોટી મળ ચળ ઉભી કરવા પ્રયાસ શોધી રહ્યા છે. જેથી આપણે ભેગા થવાનું કારણ બને છે કારણ જે આપણે કેટલાક વર્ષો થયા હીન્દુ સનાતન ધર્મ પાળતા આવ્યા છીયે ને હજુ પણ પાળતા રહેશું ને તે ધર્મ બાબત જે જે કષ્ટ પડશે તે બધા સંકોચે સહન કરશું ને [આપણા ગામમાં પણ કેટલાક મત ભેદ હોવાથી આપણે એકેશ નથી કરયું જોઈયે] જે આ નખત્રાણા ગામમાં આપણા સનાતન ધર્મ પાળનારના જન સંખ્યા કરેલ છે. જેના પણ નોંધ લેવા ને તે ભાઈયો ~~[illegible]~~ પ્રતિજ્ઞા લઈને આપે જે અમો હીન્દુ સનાતન ધર્મ પાળશું ને તે સમાજના જે જે નીયમો બહાર પડ્યા છે. તેનું પાલન કરશું ને હવે પછી જે સમાજ ધારણ તૈયાર કરશે તેનું પાલન કરવા અમો વચન આપીયે છીયે ને આ હીન્દુ ધર્મ પાળનારના કાર્યવાહકો ને ~~કાર્યવાહકો ને~~ આપણી સમાજ ઉપર નારાણ સતપંથી ભાઈયો ગમે તેવ આક્રમણ કરે તો અમે સમાજને તન-મન-ધનથી મદદ કરવા અમારે પ્રતિજ્ઞા લઈયે છીયે ને ખાસ આપીયે છીયે જે જે વખત સમાજના હુકમ થશે તેજ વખતે અમો આપણા ધર્મનું રક્ષણ કરવા તૈયાર રહેશું તે અમો આ સભામાં હાજર રહેલ ભાઈયો વચન આપીયે છીયે — જેના નોંધ નીચે મુજબ છે.

realpatidar.com

નંબર	કુટુંબના વડાનું નામ	ગામમાં જન સંખ્યા	[illegible]	[illegible]	ધર્મ શું પાળે છે.	સહીયો.
૧	રાંમજી દેસર રાંમજી [illegible] ધંધો- ખેતી-	૧૯	૮	૧૧	~~[illegible]~~ સનાતન.	રાંમજી દેસર [illegible]
૨	કાનજી ભાઈ પરબત [illegible]	૭	૨	૫	,,	[illegible]
૩	રામજી ભાઈ જેઠા [illegible]	૧૪	૩	૧૧	,,	
૪	નાનજી ભાઈ પુંજા [illegible]	૨૮	૧૪	૧૪	,,	
૫	માવજી ભાઈ [illegible]	૧૧	૬	૫	,,	[illegible]

https://archive.org/details/bk1052/page/n3/mode/1up

-Nakhtrana -Vow to come out in support of Sanatanis (1052)

KJ- BK- 4-13

	કુટુંબના વડાનું નામ	જનસંખ્યા	[illegible]	[illegible]	ધર્મ અને પાળે છે / પા. ધંધો	શાહી.
૬	પા. [illegible] નાથાણી	૧૧	૪	૭	શનાતન	[illegible]
૭	પા. [illegible]	૧૦	૩	૭	"	[illegible]
૮	પા. [illegible] નાથાણી	૧૧	૩	૮	"	[illegible]
૯	પા. [illegible] નાથાણી	૧૫	૦	૧૫	"	[illegible]
૧૦	પા. [illegible]	૩૩	૯	૨૪	"	[illegible]
૧૧	પા. [illegible]	૫	૧	૪	"	
૧૨	પા. [illegible]	૮	૨	૬	"	[illegible]
૧૩	પા. [illegible]	૪	૧	૩	"	[illegible]
૧૪	પા. [illegible]	૧૬	૩	૧૩	"	
૧૫	પા. [illegible] "	૫	૩	૨	"	[illegible]
૧૬	પા. [illegible] નાથાણી	૧૮	૫	૧૩	"	[illegible]
૧૭	પા. [illegible]	૫	૩	૨	"	[illegible]
૧૮	પા. [illegible] "	૫	૧	૪	"	[illegible]
૧૯	પા. [illegible]	૩	૦	૩	"	[illegible]
૨૦	પા. [illegible] નાથાણી	૧૭	૩	૧૪	"	
૨૧	પા. [illegible]	૭	૨	૫	"	[illegible]
૨૨	પા. [illegible]	૧૬	૪	૧૩	"	[illegible]
૨૩	પા. [illegible] નાથાણી	૫	૧	૪	"	
૨૪	પા. [illegible]	૮	૨	૬	"	[illegible]
૨૫	પા. [illegible]	૮	૦	૮	"	[illegible]
૨૬	પા. [illegible]	૮	૧	૭	"	[illegible]
૨૭	પા. [illegible]	૧૪	૨	૧૨	"	[illegible]
૨૮	પા. [illegible]	૬	૨	૪	"	[illegible]
૨૯	પા. [illegible]	૧૦	૩	૭	"	[illegible]
૩૦	પા. [illegible]	૧૧	૧	૧૦	"	[illegible]
૩૧	પા. [illegible]	૫	૧	૪	"	[illegible]
૩૨	પા. [illegible]	૧૩	૧	૧૨	"	[illegible]
૩૩	પા. [illegible]	૧૪	૪	૧૦	"	[illegible]
૩૪	પા. [illegible]	૭	૦	૭	"	[illegible]
૩૫	પા. [illegible]	૧૧	૨	૯	"	[illegible]
૩૬	પા. [illegible]	૩૧	૭	૨૪	"	[illegible]
૩૭	પા. ~~[illegible]~~ [illegible]	૩૩	૧૦	૨૩	"	[illegible]

https://archive.org/details/bk1052/page/n4/mode/1up

KJ-BK-4-14
ચાહી

	કુટુંબના વડાનું નામ	કુ. સંખ્યા	[illegible] કરતા	[illegible] કરતા	ધર્મ. [illegible]	
૩૮	ધા: રતના ગોપાલ કેસરાણી	૧૮	૪	૧૪	,,	રતના ગોપાલ કેસરાણીની સહી દા: પ્રેમજી મનજીના. દ. કે.
૩૯	ધા: પોપા ગોપાલ કેસરાણી	૧૨	૩	૯	,,	પોપા ગોપાલની સહી દા: પ્રેમજી મનજીના. દ. કે.
૪૦	ધા: ધનજી ભોગાજી સુરાણી	૭	૦	૭	,,	ધનજી ભોગાજીની સહી દાં વાલજી દેવજીના
૪૧	ધા: વાલજી દેવજી આકાણી	૭	૧	૬	,,	વાલજી દેવજીના સહી દાં પોતાના
૪૨	ધા: પુંજા માંના સુરાણી	૧૮	૪	૧૪	,,	પુંજા માંનાની સહી દાંધાં વાલજી દેવજીના
૪૩	ધા: નારણ કાનજી કેસરાણી	૬	૨	૪	,,	નારણ કાનજી ના સહી દા. પોતાના
૪૪	ધા: કરસન લધા કેસરાણી	૫	૧	૪	,,	કરસન લધાની સહી દા. નારણ કાનજીના
૪૫	ધા: મનજી ખીમજી દાવાંણી	૮	૪	૪	,,	મનજી ખીમજીની સહી દા. નારણ કાનજીના
૪૬	ધા: પમાણ ખેતા કમાણી	૭	૩	૪	,,	પમાણ ખેતાના સહી [illegible]
૪૭	ધા: ખીમજી ગોપાલ કેસરાણી	૬	૨	૪	,,	ખીમજી ગોપાલના સહી [illegible]
૪૮	ધા: શિવગણ રતના નાકરાણી	૫	૧	૪	,,	
૪૯	ધા: રામજી ખીમજી કેસરાણી	૫	૧	૪	,,	
૫૦	ધા: પરમાણી લધા લીમાણી	૩	૧	૨	,,	
૫૧	ધા: વેલા પુંજા સેંઘાણી	૭	૧	૬	,,	
૫૨	ધા: હંસરાજ કાનજી વાસાણી	૪	૧	૩	,,	
૫૩	ધા: હરજી દેવસી નાથાણી	૧૧	૨	૯	,,	
૫૪	ધા: દેવસી જેઠા સેંઘાણી	૯				
૫૫	ધા: કરસન વરસા સેંઘાણી	૮				
૫૬	ધા: લાલદાસ કાનજી કમાણી	૫	૩	૨	,,	[illegible]
૫૭	ધા: કરસન માંના સુરાણી	૧૭	૬	૧૧	,,	[illegible]
૫૮	ધા: ધનજી માંના સુરાણી	૮	૧	૭	,,	
૫૯		કુટુંબ [illegible]	[illegible]			કુલ - ૯૮ [illegible]
૬૦						
૬૧	૨૨ ૯૮					
૬૨						
૬૩						
૬૪						
૬૫						
૬૬						
૬૭						
૬૮						
૬૯						

realpatidar.com